

પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Sam

Hi, I'm Sam. Welcome to the programme!

Phil

And I'm Phil. Hello!

પ્રેઝન્ટર

મિત્રો, આજે વાત કરવી છે કચરા અને એના વ્યવસ્થાપન વિશે. વિશ્વનો દરેક દેશ કચરો ઉત્પન્ન છે અને આજે વાસ્તવિકતા એ છે કે ઘણાં દેશો પાસે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન નથી. આથી અમને વિચાર આવ્યો કે ચાલો જાણીએ કે એ કયો દેશ છે જે સૌથી વધુ પ્રમાણમાં કચરાનું 'recycle' કરે છે?

અ) સાઉથ કોરિયા

બ) મેક્સિકો

ક) જર્મની

ફેન્સ, 'recycle' નો અર્થ થાય છે નકામી થયેલી વસ્તુને ફરી વાપરી શકાય એવી બનાવવી.

Phil

Well, I've been to South Korea, and I noticed they had recycling bins everywhere.

Sam

For paper and plastic? So is that your answer, Phil?

પ્રેઝન્ટર

Wait, we'll give you the answer later in the programme! પહેલાં તમે બીબીસી દ્વારા એક પાકિસ્તાની યુવતી વિશે કરવામાં આવેલ ન્યૂઝ સાંભળો. આ યુવતીએ પોતાની અદભૂત કલાકૃતિ દ્વારા 'recycling' શબ્દનો એક નવો જ અર્થ લોકો સમક્ષ મૂક્યો છે. તેણે પોતાની કલાકૃતિ 'waste' અને 'rubbish' થી બનાવી છે. મિત્રો, 'waste' એટલે કે કચરો અને 'rubbish' એટલે કે નકામી વસ્તુઓ.

News insert

A ten-year-old schoolgirl from Pakistan has been taking general rubbish and turning it into gift bags to help clean up the growing waste problem in her country. Pakistan generates 20m tonnes of rubbish a year and the figure is growing by 2.4% annually. Could Pakistan's 'youngest social entrepreneur' have the answer? Zymal Umer estimates she has sold \$5,000 worth of bags and donates her profits to children's charities, winning multiple international awards for her work.

Sam

What a great story! This girl clearly has a real social conscience.

પ્રેઝન્ટર

'Social conscience' એટલે સામાજિક વિવેકબુદ્ધિ. Yes, and so young.

Sam

I know, it's always nice to see young people who have a social conscience and want to change things.

Phil

You and your social conscience, Sam! No, but it's true - they can then be an example to other young people, too.

Sam

Exactly, often all you need is one person to implement change and others will do the same.

પ્રેઝન્ટર

'Implement change' નો અર્થ થાય છે ફેરફાર અથવા બદલાવનો અમલ કરવો. Have either of you ever implemented any changes?

Phil

Like the girl in the story? No! But I've tried to implement small changes in my own life, like reusing plastic bags.

પ્રેઝન્ટર

I do that, too. And I also collect dry and wet waste separately. અને જ્યારે કચરાની વ્યવસ્થાપનની વાત નિકળી છે તો આગળ પૂછેલા પ્રશ્નો જવાબ આપી દઈએ. પ્રશ્ન હતો કે વિશ્વનું કચું દેશ છે જે સૌથી વધારે પ્રમાણમાં કચરાને 'recycle' કરે છે?

અ) સાઉથ કોરિયા

બ) મેક્સિકો

ક) જર્મની

મિત્રો, OECD દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા પ્રમાણે જવાબ છે ક) જર્મની. પોતાના સંસાધનો વડે જર્મની એના કુલ કચરાનું 65% જેટલા કચરાનું વ્યવસ્થાપન કરે છે. સાઉથ કોરિયા બીજા ક્રમે છે જે પોતાના કુલ કચરામાંથી 59% નું વ્યવસ્થાપન કરી રહ્યું છે.

Sam

That just shows what happens if everyone makes little changes.

Phil

It's true, we can all make a difference in small ways.

પ્રેઝન્ટર

'Make a difference' એટલે કંઈક ફેરફાર આવે તેમ વર્તન કરવું. Yes, in small ways, like we were saying earlier, with our plastic bags and collecting dry and wet waste separately.

Sam

Yeah, I often wish I could make a bigger difference than I do, though...

Phil

There's your social conscience again, Sam!

Sam

But, really. I can often see where there's a problem, but can't come up with solutions.

પ્રેઝન્ટર

'Come up with solutions' નો અર્થ થાય છે સમસ્યાનો ઉકેલ સૂચવવો. They described the schoolgirl in the story as a 'social entrepreneur'. મિત્રો, 'social entrepreneur' ને ગુજરાતીમાં કહીશું સામાજિક સાહસ ખેડનાર.

Sam

Exactly! She came up with such a creative solution to a big problem in her country.

Phil

You know, I was just thinking - I'd say that in our team, I'm the one who comes up with the most creative solutions.

Sam

You're also the one who creates all the problems, Phil!

પ્રેઝન્ટર

Oh no, maybe we need to implement some changes here! તમારા મંતવ્યો જણાવો મિત્રો? વિશ્વમાં વધી રહેલાં કચરા અને નકામી વસ્તુઓ અંગે તમે શું માનો છો? શું કરવાથી તમારા દેશમાં 'make a difference' થશે? તમારા મતે આ સમસ્યા માટે કોને 'come up with solutions' જેવો અભિગમ અપનાવવો પડશે?

આજે સામાજિક પ્રશ્નો અને એના સામાધાન સાથે સંલગ્ન જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. 'Social conscience' એટલે સામાજિક સદવિવેકબુદ્ધિ જ્યારે 'implement change' નો અર્થ થાય છે ફેરફાર અથવા બદલાવનો અમલ કરવો.

'Make a difference' એટલે કંઈક ફેરફાર આવે તેમ વર્તન કરવું અને 'come up with solutions' નો અર્થ થાય છે સમસ્યાનો ઉકેલ સૂચવવો. આવા જ બીજા રસપ્રદ ટોપિક સાથે ફરીથી મળીશું English Togetherમાં... ત્યાં સુધી Bye!